

# Mic

## Chapter 2

Gujarati Interlinear

Reference: American Standard Version

יַעֲשׂוּהָ તેઓ-કરે-છે-તે	הַבֹּקֶר સવારના	בְּאֹר પ્રકાશમાં	מִשְׁכְּבוֹתָם તેમના-પલંગો-પર	עַל- ઉપર	רָע અનિષ્ટ	וַיַּעֲלֵי અને-કરનારાઓ	אֶנּוֹן દુષ્ટતાના	הַשְּׁבִי- વિચારનારાઓ	הַיּוֹם અરે	1
	<a href="#">H1242</a>	<a href="#">H0216</a>	<a href="#">H4904</a>			<a href="#">H6466</a>	<a href="#">H0205</a>	<a href="#">H2803</a>	<a href="#">H1945</a>	
						יָדָם: તેમના-હાથમાં	לְאֵל ઈશ્વરની-શક્તિ	יֵשׁ- છે	כִּי કારણ-કે	
						<a href="#">H3027</a>	<a href="#">H0410</a>	<a href="#">H3426</a>		

Woe to them that devise iniquity and work evil upon their beds! when the morning is light, they practise it, because it is in the power of their hand.

וּבֵיתוֹ અને-તેના-ઘર-પર	וְגַר માણસ-પર	וְעֵשְׂקוֹ અને-ત્રાસ-આપે-છે	וְנִשְׂאוֹ અને-લઈ-લે-છે	וּבְתָיִם અને-ઘરો	וְנִזְוָלוֹ અને-છીનવે-છે	שָׂדֵת પેતરો	וְחֲמֻדוֹ અને-લાલચ-કરે-છે			2
	<a href="#">H1397</a>	<a href="#">H6231</a>	<a href="#">H5375</a>		<a href="#">H1497</a>					
						פְּ —	וְנִחְלָתוֹ: અને-તેના-વારસા-પર	וְאִישׁ અને-વ્યક્તિ-પર		
							<a href="#">H5159</a>	<a href="#">H0376</a>		

And they covet fields, and seize them; and houses, and take them away: and they oppress a man and his house, even a man and his heritage.

לֹא- નહિ	אָשַׁר જેમાંથી	רָעָה અનિષ્ટ	הַזֹּאת આ	הַמְשַׁפְּתָהּ આ-કુટુંબના	עַל- વિરુદ્ધ	הַשֵּׁב વિચારું-છું	הַנְּגִי જુઓ-હું	יְהוָה યહોવાહ	אָמַר કહે-છે	כֹּה આમ	לְכֹן માટે	3
<a href="#">H3808</a>			<a href="#">H2063</a>	<a href="#">H4940</a>		<a href="#">H2803</a>	<a href="#">H2009</a>	<a href="#">H3068</a>	<a href="#">H0559</a>	<a href="#">H3541</a>		
		הָיָא: છે-તે	רָעָה અનિષ્ટનો	עַתָּה સમય	כִּי કારણ-કે	רוֹמְתָהּ ગર્વથી	תִּלְכֹּנָהּ ચાલશો	וְלֹא અને-નહિ	צִוְּאַתְּ יֹכְחֶם તમારી-ગરદનો	מִשָּׁם ત્યાંથી	תִּמְשִׁי છૂટાવી-શકશો	
		<a href="#">H1931</a>		<a href="#">H6256</a>		<a href="#">H7317</a>	<a href="#">H3212</a>	<a href="#">H3808</a>		<a href="#">H8033</a>	<a href="#">H4185</a>	

Therefore thus saith Jehovah: Behold, against this family do I devise an evil, from which ye shall not remove your necks, neither shall ye walk haughtily; for it is an evil time.

שָׂדֵד સંપૂર્ણપણે	אָמַר કહેશે	נְהַיָּה થયું-છે	נְהַי વિલાપ	וְנָהָה અને-વિલાપ-કરશે	מִשָּׁל દુષ્ટાત	עַל יֹכְחֶם તમારી-વિરુદ્ધ	יִשָּׂא ઉઠાવશે	הָהוּא તે	בַּיּוֹם તે-દિવસે	4
<a href="#">H7703</a>	<a href="#">H0559</a>	<a href="#">H5093</a>	<a href="#">H5092</a>	<a href="#">H5091</a>	<a href="#">H4912</a>		<a href="#">H5375</a>	<a href="#">H1931</a>	<a href="#">H3117</a>	
שָׂדֵינוּ આપણાં-પેતરો	לְשׂוֹבֵב વિશ્વાસઘાતી-ને	לִי મારાથી	יְמִישׁ દૂર-થાય-છે	אֵיךְ કેવી-રીતે	יְמִיר બદલાય-છે	עַמִּי મારા-લોકોનો	חֲלָק ભાગ	נִשְׂרָפוּ આપણે-લૂંટાયા		
	<a href="#">H7728</a>		<a href="#">H4185</a>		<a href="#">H4171</a>			<a href="#">H7703</a>		
								יְחַלְקֵם: વહેંચે-છે		

In that day shall they take up a parable against you, and lament with a doleful lamentation, and say, We are utterly ruined: he changeth the portion of my people: how doth he remove it from me! to the rebellious he divideth our fields.

יְהוָה: યહોવાહની	בְּקָהָל સભામાં	בְּגוֹרָל ચિઠ્ઠી-ઢાંરા	חֲבֹל ભાગ	מִשָּׁלְךָ દેરી-ફેંકનાર	לְךָ તારા-માટે	יְהוָה હશે	לֹא- નહિ	לְכֹן માટે	5
<a href="#">H3068</a>	<a href="#">H6951</a>	<a href="#">H1486</a>		<a href="#">H7993</a>		<a href="#">H1961</a>	<a href="#">H3808</a>		

Therefore thou shalt have none that shall cast the line by lot in the assembly of Jehovah.



